

१ थिषलनीક્રિન: પત્રં

I પૌલ: સિલ્વાનસ્તીમથિયશ્ચ પિતુરીશ્વરસ્ય પ્રભો ર્થીશુખ્રીષ્ટસ્ય યાશ્રયં પ્રાપ્તા થિષલનીકીયસમિતિં પ્રતિ પત્રં લિખન્તિ। અસ્માકં તાત ઈશ્વર: પ્રભુ ર્થીશુખ્રીષ્ટશ્ચ યુષ્માન્ પ્રત્યનુગ્રહં શાન્તિઞ્ચ ક્રિયાસ્તાં।

II વયં સર્વેષાં યુષ્માકં કૃતે ઈશ્વરં ધન્યં વદામ: પ્રાર્થનાસમયે યુષ્માકં નામોચ્ચારયામ:,

III અસ્માકં તાતસ્યેશ્વરસ્ય સાક્ષાત્ પ્રભૌ યીશુખ્રીષ્ટે યુષ્માકં વિશ્વાસેન યત્ કાર્ય્યં પ્રેમ્ના ય: પરિશ્રમ: પ્રત્યાશયા ચ યા તિતિક્ષા જાયતે

IV તત્ સર્વ્યં નિરન્તરં સ્મરામશ્ચા હે પિયભ્રાતર:, યૂયમ્ ઈશ્વરેણાભિરુચિતા લોકા ઇતિ વયં જાનીમઃ।

V યતોડસ્માકં સુસંવાદ: કેવલશબ્દેન યુષ્માન્ ન પ્રવિશ્ય શક્ત્યા પવિત્રેણાત્મના મહોત્સાહેન ચ યુષ્માન્ પ્રાવિશત્। વચન્તુ યુષ્માકં કૃતે યુષ્મન્મધ્યે કીદૃશા અભવામ તદ્ યુષ્માભિ જ્ઞાયતે।

VI યૂયમપિ બહુકલેશભોગેન પવિત્રેણાત્મના દત્તેનાનન્દેન ચ વાક્યં ગૃહીત્વાસ્માકં પ્રભોશ્ચાનુગામિનોડભવતા

VII તેન માકિદનિયાખાયાદેશયો ર્યાવન્તો વિશ્વાસિનો લોકા: સન્તિ યૂયં તેષાં સર્વેષાં નિદર્શનસ્વરૂપા જાતા:।

VIII યતો યુષ્મત્ત: પ્રતિનાદિતયા પ્રભો વર્ણયા માકિદનિયાખાયાદેશૌ વ્યાપ્તૌ કેવલમેતન્નહિ કિન્ત્વીશ્વરે યુષ્માકં યો વિશ્વાસસ્તસ્ય વાર્તા સર્વત્રાશ્રાવિ, તસ્માત્ તત્ર વાક્યકથનમ્ અસ્માકં નિષ્પ્રયોજનં।

IX યતો યુષ્મન્મધ્યે વયં કીદૃશં પ્રવેશં પ્રાપ્તા યૂયન્ચ કથં પ્રતિમા વિહાયેશ્વરં પ્રત્યાવર્ત્તધ્વમ્ અમરં સત્યમીશ્વરં સેવિતું

X મૃતગણમધ્યાચ્ચ તેનોત્યાપિતસ્ય પુત્રસ્યાર્થત આગામિકોઘાદ્ અસ્માકં નિસ્તારયિતુ ર્થીશો: સ્વર્ગાદ્ આગમનં પ્રતીક્ષિતુમ્ આરભધ્વમ્ એતત્ સર્વ્યં તે લોકા: સ્વયમ્ અસ્માન્ જ્ઞાપયન્તિ।

II

I હે ભ્રાતરઃ, યુષ્મન્મધ્યે ડસ્માકં પ્રવેશો નિષ્ફલો ન જાત ઇતિ યૂયં સ્વયં જાનીથા

II અપરં યુષ્માભિ ર્થયાશ્રાવિ તથા પૂર્વ્વં ફિલિપીનગરે ક્લિષ્ટા નિન્દિતાશ્ચ સન્તોડપિ વયમ્ ઈશ્વરાદ્ ઉત્સાહં લબ્ધ્વા બહુયત્નેન યુષ્માન્ ઈશ્વરસ્ય સુસંવાદમ્ અબોધયામા

III યતોડસ્માકમ્ આદેશો ભ્રાન્તેરશુચિભાવાદ્ વોત્પન્નઃ પ્રવચ્ચનાયુક્તો વા ન ભવતિ

IV કિન્ત્વીશ્વરેણાસ્માન્ પરીક્ષ્ય વિશ્વસનીયાન્ મત્વા ચ યદ્વત્ સુસંવાદોડસ્માસુ સમાર્થત તદ્વદ્ વયં માનવેભ્યો ન રુરોચિષમાણાઃ કિન્ત્વસ્મદન્તઃકરણાનાં પરીક્ષકાયેશ્વરાય રુરોચિષમાણા ભાષામહે

V વયં કદાપિ સ્તુતિવાદિનો નાભવામેતિ યૂયં જાનીથ કદાપિ છલવસ્ત્રેણ લોભં નાચ્છાદયામેત્યસ્મિન્ ઈશ્વરઃ સાક્ષી વિદ્યતો

VI વયં પ્રીષ્ટસ્ય પ્રેરિતા ઇવ ગૌરવાન્વિતા ભવિતુમ્ અશક્ષ્યામ કિન્તુ યુષ્મન્તઃ પરસ્માદ્ વા કસ્માદપિ માનવાદ્ ગૌરવં ન લિપ્સમાના યુષ્મન્મધ્યે મૃદુભાવા ભૂત્વાવર્ત્તમિહિ

VII યથા કાયિન્માતા સ્વકીયશિશૂન્ પાલયતિ તથા વયમપિ યુષ્માન્ કાડ્ઠક્ષમાણા

VIII યુષ્મભ્યં કેવલમ્ ઈશ્વરસ્ય સુસંવાદં તન્નહિ કિન્તુ સ્વકીયપ્રાણાન્ અપિ દાતું મનોભિરભ્યલધામ, યતો યૂયમ્ અસ્માકં સ્નેહપાત્રાણ્યભવતા

IX હે ભ્રાતરઃ, અસ્માકં શ્રમઃ કલેશશ્ચ યુષ્માભિઃ સ્મર્ય્થતે યુષ્માકં કોડપિ યદ્ ભારગ્રસ્તો ન ભવેત્ તદર્થં વયં દિવાનિશં પરિશ્રામ્યન્તો યુષ્મન્મધ્ય ઈશ્વરસ્ય સુસંવાદમઘોષયામા

X અપરચ્ચ વિશ્વાસિનો યુષ્માન્ પ્રતિ વયં કીદ્દક્ પવિત્રત્વયથાર્થત્વનિર્દોષત્વાચારિણોડભવામેત્યસ્મિન્ ઈશ્વરો યૂયચ્ચ સાક્ષિણ આધ્વે

XI અપરચ્ચ યદ્વત્ પિતા સ્વબાલકાન્ તદ્વદ્ વયં યુષ્માકમ્ એકેકં જનમ્ ઉપદિષ્ટવન્તઃ સાન્તિવતવન્તશ્ચ,

XII ચ ઈશ્વરઃ સ્વીયરાજ્યાય વિભવાય ચ યુષ્માન્ આહૂતવાન્ તદ્દુપયુક્તાચરણાય યુષ્માન્ પ્રવર્ત્તિતવન્તશ્ચેતિ યૂયં જાનીથા

XIII यस्मिन् समये यूयम् अस्माकं मुखाद् ईश्वरेण प्रतिश्रुतं वाक्यम् अलभध्वं तस्मिन् समये तत् मानुषाणां वाक्यं न मत्त्वेश्वरस्य वाक्यं मत्वा गृहीतवन्त एति कारणाद् वयं निरन्तरम् ईश्वरं धन्यं वदामः, यतस्तद् ईश्वरस्य वाक्यम् एति सत्यं विश्वासिनां युष्माकं मध्ये तस्य गुणः प्रकाशते या

XIV हे भ्रातरः, प्रीष्टाश्रितवत्य ईश्वरस्य याः समित्यो यिद्धृदादेशे सन्ति यूयं तासाम् अनुकारिणोऽभवत्, तद्भुक्ता लोकाश्च यद्गद् यिद्धृदिलोकेभ्यस्तद्गद् यूयमपि स्वजातीयलोकेभ्यो दुःखम् अलभध्वं

XV ते यिद्धृदीयाः प्रभुं यीशुं भविष्यद्वादिनश्च उतवन्तो ऽस्मान् दूरीकृतवन्तश्च, त ईश्वराय न रोयन्ते सर्वेषां मानवानां विपक्षा भवन्ति यैः

XVI अपरं भिन्नजातीयलोकानां परित्राणार्थं तेषां मध्ये सुसंवाद्येषणाद् अस्मान् प्रतिषेधन्ति येत्थं स्वीयपापानां परिमाणम् उत्तरोत्तरं पूरयन्ति, किन्तु तेषाम् अन्तकारी क्रोधस्तान् उपक्रमते।

XVII हे भ्रातरः मनसा नहि किन्तु वदनेन कियत्कालं युष्मतो ऽस्माकं विच्छेदे जाते वयं युष्माकं मुष्मानि द्रष्टुम् अत्याकाङ्क्षया षडु यतितवन्तः।

XVIII द्विरेककृत्वो वा युष्मत्समीपगमनायास्माकं विशेषतः पौलस्य ममाभिलाषोऽभवत् किन्तु शयतानो ऽस्मान् निवारितवान्।

XIX यतोऽस्माकं का प्रत्याशा को वानन्दः किं वा श्लाघ्यकिरीटं? अस्माकं प्रभो यीशुप्रीष्टस्यागमनकाले तत्सम्पुजस्था यूयं किं तन्न भविष्यथ?

XX यूयम् अस्माकं गौरवानन्दस्वर्पा भवथा

III

I अतोऽहं यदा सन्देहं पुनः सोढुं नाशक्नुवं तदानीम् आथीनीनगर अेकाकी स्थातुं निश्चित्य

II स्वभ्रातरं प्रीष्टस्य सुसंवादे सहकारिणेश्वरस्य परियारकं तीमथियं युष्मत्समीपम् अप्रेषयं।

III वर्तमानैः क्लेशैः कस्यापि यात्रल्यं यथा नु ज्ञायते तथा ते त्वया स्थिरीक्रियन्तां स्वकीयधर्ममधि समाश्रास्यन्ताञ्चेति तम् आदिशं।

IV वयमेतादृशे क्लेशे नियुक्ता आस्मलु इति यूयं स्वयं ज्ञानीथ, यतोऽस्माकं दुर्गति र्भविष्यतीति वयं युष्माकं समीपे स्थितिकालेऽपि युष्मान् अबोधयाम, तादृशमेव याभवत् तदपि ज्ञानीथा

V तस्मात् परीक्षकेषु युष्मासु परीक्षितेष्वस्माकं परिश्रमो विद्दुलो भविष्यतीति त्वयं सोढुं यदाहं नाशक्नुवं तदा युष्माकं विश्वासस्य तत्त्वावधारणाय तम् अप्रेषयं।

VI किन्त्वधुना तीमथियो युष्मत्समीपाद् अस्मत्सन्निधिम् आगत्य युष्माकं विश्वासप्रेमणी अध्वस्मान् सुवार्तां ज्ञापितवान् वयञ्च यथा युष्मान् स्मरामस्तथा यूयमप्यस्मान् सर्व्वदा प्रणयेन स्मरथ द्रष्टुम् आकाङ्क्षध्वे येति कथितवान्।

VII हे भ्रातरः, वार्तामिमां प्राप्य युष्मानधि विशेषतो युष्माकं क्लेशदुःखान्यधि युष्माकं विश्वासाद् अस्माकं सान्त्वनाज्ञायत;

VIII यतो यूयं यद्वि प्रभाववतिष्ठथ तर्हनेन वयम् अधुना ज्ञुवामः।

IX वयञ्चास्मदीयेश्वरस्य साक्षाद् युष्मत्तो ज्ञातेन येनानन्देन प्रकुल्ला भवामस्तस्य कृत्स्नस्यानन्दस्य योग्यरूपेश्वरं धन्यं वदितुं कथं शक्यामः?

X वयं येन युष्माकं वदनानि द्रष्टुं युष्माकं विश्वासे यद् असिद्धं विद्यते तत् सिद्धीकर्तुञ्च शक्यामस्तादृशं वरं दिवानिशं प्रार्थयामहे।

XI अस्माकं तातेनेश्वरेण प्रभुना यीशुप्रीष्टेन य युष्मत्समीपगमनायास्माकं पन्था सुगमः क्रियतां।

XII परस्परं सर्व्वैश्च प्रति युष्माकं प्रेम युष्मान् प्रति यास्माकं प्रेम प्रभुना वर्द्धयतां बहुकुलं क्रियताञ्च।

XIII अपरमस्माकं प्रभु र्गीशुप्रीष्टः स्वकीयैः सर्व्वैः पवित्रलोकैः सार्द्धं यदागमिष्यति तदा यूयं यथास्माकं तातस्येश्वरस्य सम्भुषे पवित्रतया निर्दोषा भविष्यथ तथा युष्माकं मनांसि स्थिरीक्रियन्तां।

IV

I હે ભ્રાતરઃ, યુષ્માભિઃ કીદૃગ્ આચરિતવ્યં ઈશ્વરાય રોચિતવ્યઞ્ચ તદધ્યસ્મત્તો યા શિક્ષા લબ્ધા તદનુસારાત્ પુનરતિશયં યત્નઃ ક્રિયતામિતિ વયં પ્રભુયીશુના યુષ્માન્ વિનીયાદિશામઃ

II યતો વયં પ્રભુયીશુના કીદૃશીરાજ્ઞા યુષ્માસુ સમર્પિતવન્તસ્તદ્ યૂયં જ્ઞાનીથા

III ઈશ્વરસ્થાયમ્ અભિલાષો યદ્ યુષ્માકં પવિત્રતા ભવેત્, યૂયં વ્યભિચારાદ્ દૂરે તિષ્ઠતા

IV યુષ્માકમ્ એકૈકો જનઃ સ્વકીયં પ્રાણાધારં પવિત્રં માન્યઞ્ચ રક્ષતુ,

V યે ચ ભિન્નજાતીયા લોકા ઈશ્વરં ન જ્ઞાનન્તિ ત ઇવ તત્ કામાભિલાષસ્થાધીનં ન કરોતુ

VI એતસ્મિન્ વિષયે કોઽપ્યત્યાચારી ભૂત્વા સ્વભ્રાતરં ન વઞ્ચયતુ યતોઽસ્માભિઃ પૂર્વ્વં યથોક્તં પ્રમાણીકૃતઞ્ચ તથૈવ પ્રભુરેતાદૃશાનાં કર્મ્મણાં સમુચિતં ફલં દાસ્યતિ

VII યસ્માદ્ ઈશ્વરોઽસ્માન્ અશુચિતાયૈ નાહૂતવાન્ કિન્તુ પવિત્રત્વાયૈવાહૂતવાન્

VIII અતો હેતો ર્યઃ કશ્ચિદ્ વાક્યમેતન્ન ગૃહ્ણાતિ સ મનુષ્યમ્ અવજાનાતીતિ નહિ યેન સ્વકીયાત્મા યુષ્મદન્તરે સમર્પિતસ્તમ્ ઈશ્વરમ્ એવાવજાનાતિ

IX ભ્રાતૃષુ પ્રેમકરણમધિ યુષ્માન્ પ્રતિ મમ લિખનં નિષ્પ્રયોજનં યતો યૂયં પરસ્પરં પ્રેમકરણાયેશ્વરશિક્ષિતા લોકા આધ્વો

X કૃત્સ્ને માકિદનિયાદેશે ચ યાવન્તો ભ્રાતરઃ સન્તિ તાન્ સર્વાન્ પ્રતિ યુષ્માભિસ્તત્ પ્રેમ પ્રકાશયતે તથાપિ હે ભ્રાતરઃ, વયં યુષ્માન્ વિનયામહે યૂયં પુન ભ્દુતરં પ્રેમ પ્રકાશયતા

XI અપરં યે બહિઃસ્થિતાસ્તેષાં દૃષ્ટિગોચરે યુષ્માકમ્ આચરણં યત્ મનોરમ્યં ભવેત્ કસ્યાપિ વસ્તુનશ્ચાભાવો યુષ્માકં યન્ન ભવેત્,

XII એતદર્થં યૂયમ્ અસ્મત્તો યાદૃશમ્ આદેશં પ્રાપ્તવન્તસ્તાદૃશં નિર્વિરોધાચારં કર્તુ સ્વસ્વકર્મ્મણિ મનામિ નિધાતું નિજકરૈશ્ચ કાર્ય સાધયિતું યતધ્વાં

XIII હે ભ્રાતરઃ નિરાશા અન્યે લોકા ઇવ યૂયં યન્ન શોચેધ્વં તદ્દથ મહાનિદ્રાગતાન્ લોકાનઘિ યુષ્માકમ્ અજ્ઞાનતા મયા નાભિલષ્યતે।

XIV યીશુ મૃતવાન્ પુનરુથિતવાંશ્ચેતિ યદિ વયં વિશ્વાસમસ્તર્હિ યીશુમ્ આશ્રિતાન્ મહાનિદ્રાપ્રાપ્તાન્ લોકાનપીશ્વરોડવશ્યં તેન સાર્દ્ધમ્ આનેષ્યતિ।

XV યતોડહં પ્રભો વાક્યેન યુષ્માન્ ઇદં જ્ઞાપયામિ; અસ્માકં મધ્યે યે જનાઃ પ્રભોરાગમનં યાવત્ જીવન્તોડવશેક્ષ્યન્તે તે મહાનિદ્રિતાનામ્ અગ્રગામિનોન ન ભવિષ્યન્તિ;

XVI યતઃ પ્રભુઃ સિંહનાદેન પ્રધાનસ્વર્ગદ્વૃતસ્યોચ્ચૈઃ શબ્દેનેશ્વરીયતૂરીવાદેન ચ સ્વયં સ્વર્ગાદ્ અવરોક્ષ્યતિ તેન પ્રીષ્ટાશ્રિતા મૃતલોકાઃ પ્રથમમ્ ઉત્થાસ્યાન્તિ।

XVII અપરમ્ અસ્માકં મધ્યે યે જીવન્તોડવશેક્ષ્યન્તે ત આકાશે પ્રભોઃ સાક્ષાત્કરણાર્થં તૈઃ સાર્દ્ધં મેઘવાહનેન હરિષ્યન્તે; ઇત્યઞ્ચ વયં સર્વ્વદા પ્રભુના સાર્દ્ધં સ્થાસ્યામઃ।

XVIII અતો યૂયમ્ એતાભિઃ કથાભિઃ પરસ્પરં સાન્ત્વયતા।

V

I હે ભ્રાતરઃ, કાલાન્ સમયાંશ્ચાઘિ યુષ્માન્ પ્રતિ મમ લિખનં નિષ્પ્રયોજનં,

II યતો રાત્રૌ યાદૃક્ તસ્કરસ્તાદૃક્ પ્રભો દિનમ્ ઉપસ્થાસ્યતીતિ યૂયં સ્વયમેવ સમ્યગ્ જ્ઞાનીથા।

III શાન્તિ નિર્વિવિઘ્નત્વઞ્ચ વિદ્યત્ ઇતિ યદા માનવા વદિષ્યન્તિ તદા પ્રસવવેદના યદ્દદ્ ગર્ભિનીમ્ ઉપતિષ્ઠતિ તદ્દદ્ અકસ્માદ્ વિનાશસ્તાન્ ઉપસ્થાસ્યતિ તૈરુદ્ધારો ન લપ્સ્યતે।

IV કિન્તુ હે ભ્રાતરઃ, યૂયમ્ અન્ધકારેણાવૃતા ન ભવથ તસ્માત્ તદ્દિનં તસ્કર ઇવ યુષ્માન્ ન પ્રાપ્સ્યતિ।

V સર્વ્વે યૂયં દીપ્તેઃ સન્તાના દિવાયાશ્ચ સન્તાના ભવથ વયં નિશાવંશાસ્તિમિરવંશા વા ન ભવામઃ।

VI અતો ડપરે યથા નિદ્રાગતાઃ સન્તિ તદ્દદ્ અસ્માભિ ન ભવિતવ્યં કિન્તુ જાગરિતવ્યં સચેતનૈશ્ચ ભવિતવ્યં।

VII ये निद्रान्ति ते निशायामेव निद्रान्ति ते य मत्ता भवन्ति ते रञ्ज्यामेव मत्ता भवन्ति।

VIII किन्तु वयं दिवसस्य वंशा भवामः; अतो ऽस्माभिर्वक्षसि प्रत्ययप्रेमरूपं क्वयं शिरसि य परित्राणाशाशरूपं शिरस्त्रं परिधाय सयेतनैर्भवितव्यं।

IX यत ईश्वरोऽस्मान् क्रोधे न नियुज्यास्माकं प्रभुना यीशुप्रीष्टेन परित्राणस्याधिकारे नियुक्तवान्,

X जाग्रतो निद्रागता वा वयं यत् तेन प्रभुना सह श्रुवामस्तदर्थं सोऽस्माकं कृते प्राणान् त्यक्तवान्।

XI अतश्चैव यूयं यद्दत् कुरुथ तद्दत् परस्परं सान्त्वयत सुस्थिरीकुरुध्वञ्च।

XII हे भ्रातरः, युष्माकं मध्ये ये जनाः परिश्रमं कुर्वन्ति प्रभो नार्मिना युष्मान् अधितिष्ठन्त्युपदिशन्ति य तान् यूयं सम्मन्यध्वं।

XIII स्वकर्महेतुना य प्रेम्ना तान् अतीवाद्यध्वमिति मम प्रार्थना, यूयं परस्परं निर्विरोधा भवत।

XIV हे भ्रातरः, युष्मान् विनयामहे यूयम् अविडितायारिणो लोकान् भर्त्सयध्वं, क्षुद्रमनसः सान्त्वयत, दुर्बलान् उपकुरुत, सर्वाङ्गान् प्रति सङ्घिषणो भवत या।

XV अपरं कमपि प्रत्यनिष्टस्य इलम् अनिष्टं केनापि यन्न क्रियेत तदर्थं सावधाना भवत, किन्तु परस्परं सर्वाङ्गान् मानवांश्च प्रति नित्यं वितायारिणो भवत।

XVI सर्व्वदानन्दता।

XVII निरन्तरं प्रार्थनां कुरुध्वं।

XVIII सर्व्वविषये कृतज्ञतां स्वीकुरुध्वं यत अेतदेव प्रीष्टयीशुना युष्मान् प्रति प्रकाशितम् ईश्वराभिमतं।

XIX पवित्रम् आत्मानं न निर्व्वापयत।

XX ईश्वरीयादेशं नावजानीत।

XXI सर्वाङ्गिणो परीक्ष्य यद्दत् तदेव धारयत।

XXII यत् किमपि पापरूपं भवति तस्माद् दूरं तिष्ठत।

XXIII शान्तिदायक ईश्वरः स्वयं युष्मान् सम्पूर्णात्वेन पवित्रान् करोतु,
अपरम् अस्मत्प्रभो र्थीशुष्प्रीष्टस्यागमनं यावद् युष्माकम् आत्मानः
प्राणाः शरीराणि च निष्किलानि निर्दोषत्वेन रक्षयन्तां

XXIV यो युष्मान् आह्वयति स विश्वसनीयोऽतः स तत् साधयिष्यति

XXV हे भ्रातरः, अस्माकं कृते प्रार्थनां कुरुध्वं

XXVI पवित्रयुम्बनेन सर्वान् भ्रातृन् प्रति सत्कुरुध्वं

XXVII पत्रमिदं सर्वेषां पवित्राणां भ्रातृणां श्रुतिगोचरे युष्माभिः
पठ्यतामिति प्रभो नमिन्ना युष्मान् शपयामि

XXVIII अस्माकं प्रभो र्थीशुष्प्रीष्टस्यानुग्रहे युष्मासु भूयात् आमेन्

**Sanskrit Bible (NT) in Gujarati Script
New Testament in Sanskrit Language; printed in
Gujarati Script**

copyright © 2018 SanskritBible.in

Language: Sanskrit

Contributor: SanskritBible.in

Thank you for your interest in Sanskrit Bible.

Sanskrit Bible (NT) is freely available in 22 different scripts of your choice. This edition is in Gujarati script and is based on the Sanskrit translation of the Holy Bible published by Calcutta Baptist Missionaries in 1851. Please visit SanskritBible.in to learn more about Sanskrit Bible and to download various free Christian literature.

This translation is made available to you under the terms of the Creative Commons Attribution Share-Alike license 4.0.

You have permission to share and redistribute this Bible translation in any format and to make reasonable revisions and adaptations of this translation, provided that:

You include the above copyright and source information.

If you make any changes to the text, you must indicate that you did so in a way that makes it clear that the original licensor is not necessarily endorsing your changes.

If you redistribute this text, you must distribute your contributions under the same license as the original.

Pictures included with Scriptures and other documents on this site are licensed just for use with those Scriptures and documents. For other uses, please contact the respective copyright owners.

Note that in addition to the rules above, revising and adapting God's Word involves a great responsibility to be true to God's Word. See Revelation 22:18-19.

2020-01-01

PDF generated using Haiola and XeLaTeX on 22 Feb 2024 from source files dated 29 Jan 2022

e1290797-4477-53f0-873d-c9153a72fd01